



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૦૧/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૮ વ્યક્તિઓને ઝડપી, ૧૧૪ લીટર દેશી દારૂ, ૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૬૫ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, ૧ સ્ફૂટર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૧ કેસ કરી, ૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૯૨/૧૯

મણીનગર: કનુભાઈ પથ્યુભાઈ સોલંકી (ઉ.વ.૪૨) (રહે. ઇશ્વરબાગ સોસાયટી શારદા સ્કુલની બાજુમાં) એ તા.૨૯/૦૧/૧૯ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૧/૧૯ કલાક ૧૦/૨૦ થી તા.૨૮/૦૧/૧૯ કલાક ૭/૩૦ વાગ્યા દરમિયાન અર્જુન રાણા તથા અજાણ્યા ઇસમોએ કનુભાઈના નવરંગપુરા શાખાના એચ.ડી.એફ.સી.બેન્ક ખાતુ ઇન્ટરનેટના માધ્યમથી નેટ બેન્કીંગ દ્વારા ઓન લાઇન કરી અથવા કનુભાઈનુ યુઝર આઇ.ડી.તથા પાસવર્ડ ચેનકેન પ્રકારે મેળવી કનુભાઈના ખાતામાંથી આર.ટી.જી.એસ.મારફતે રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- વીટી એન્ટર પ્રાઇઝ ખાનપુર બ્રાન્ચ દિલ્લીના ખાતામાં ટ્રાન્સફર કરી તે એકાઉન્ટમાંથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં અર્જુન રાણાએ ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એસ.એમ.પટેલ ચલાવે છે.

કાલુપુર: દર્શિલભાઈ રમેશભાઈ શેઠ (ઉ.વ.૩૧) (રહે.સાનિધ્ય પાર્ક એપાર્ટમેન્ટ ખારાવાલા માર્કેટ મીઠાખળી) એ તા.૨૯/૦૧/૧૯ નારોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૧/૧૯ સવારના ૧૧/૪૫ વાગ્યાના સુમારે દર્શિલ શેઠના મોબાઈલ ફોન ઉપર મોબાઈલ નંબર ૯૮૭૫૫૬૩૪૫૨ ના ધારકે દર્શિલ શેઠને ફોન કરી બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તરીકે ઓળખ આપી એ.ટી.એમ.એક્સ્પાયરી તારીખ, સી.વી.વી નંબર તથા ઓ.ટી.પી નંબર મેળવી લઈ ખાતામાંથી કુલ રૂપિયા ૧,૨૨,૦૦૦/- ઉપાડાવી અલગ-અલગ જગ્યા ઉપર વપરાશ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી આર.જી.દેસાઈ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૯૩/૧૯

નારોલ: હર્ષાલભાઈ કુનુભાઈ ગણાત્રા (રહે.તુલસી બંગલોઝ જોધપુર સેટેલાઈટ) એ તા.૨૯/૦૧/૧૯ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૦૧/૧૯ સાંજના ૬/૩૦ થી તા.૨૮/૦૧/૧૯ કલાક ૬/૩૦ વાગ્યા દરમ્યાન નારોલ ઓમશાંતિનગર વિભાગ-૨ પાછળ એ.ઈ.એમ.નામની સ્કુલની તિજોરીમાંથી રોકડ રૂપિયા ૧,૫૮,૪૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી મફતસિંહ ગફુરસિંહ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૯૪/૧૯

રીવરફ્રન્ટ ઇસ્ટ: વાલજીભાઈ ભુદરભાઈ મકવાણા (ઉ.વ.૭૪) (રહે. સ્વામી રેસેડેન્સી વિભાગ-૫ સમર પ્લાજા પાસે આઈઓસી રોડ ચાંદખેડા) એ બિમારીથી કંટાળી તા.૨૯/૦૧/૧૯ બપોરના ૪/૩૦ વાગ્યા પહેલા રિવરફ્રન્ટ ગાર્ડન ગેટ નંબર-૩ પાછળ નદીમાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી જસવંતભાઈ વિરમાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.